

સ્ટાર્ટ અપ સેન્ટર્સમાં 43% હિસ્સા સાથે અમદાવાદનું કદ વધ્યું

ઇટી બ્યુરો

અમદાવાદ



છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારે સ્ટાર્ટ-અપ કલ્યાણે વેગ આપવા લીધેલાં પગલાં, ઇન્ક્યુબેર્સની સહિય ભૂમિકા, સ્થાનિક સમૃદ્ધાચો અને શૈક્ષણિક સંસ્થાઓના સતત પ્રયાસોને પગલે ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમે દુનિયામાં ગીજું સ્થાન હાસલ કર્યું છે.

નાસ્કોમ-ડિઝનોવના અભ્યાસ પ્રમાણે દેશમાં ઓકોટોબર ૨૦૧૮ સુધીમાં ચુનિકોર્ન સ્ટાર્ટ-અપ્સ (એક અભજ કોલરથી વધારે વેલ્યુએશન)ની સંખ્યા ૨૪ હતી. વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૮ વચ્ચે નવ હજારથી વધુ સ્ટાર્ટ-અપ્સની સ્થાપના થઈ હતી અને એમાં વાર્ષિક ધોરણે સરેરાશ રીથી ૧૫ ટકાનાં દરે વૃદ્ધિ થઈ હતી. સ્ટાર્ટ-અપ કેન્દ્રોમાં વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૮ દરમિયાન વિકસતાં કેન્દ્રોમાં આશરે ૧૫૦ સ્ટાર્ટ-અપ્સનાંથી આશરે ૪૩ ટકા ફેડ સ્ટાર્ટઅપ્સ અમદાવાદમાં છે. વિકસતાં કેન્દ્રોમાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં ૫૫ ટકાનો વધારો થયો છે, જ્યારે ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં ૧૨થી ૧૫ ટકાની વૃદ્ધિ થઈ છે.

નાસ્કોમ-ડિઝનોવના રિપોર્ટમાં અમદાવાદ ઉપરાંત જ્યાપુર, કોલકાતા અને કોચ્ચી વિકાસશીલ સ્ટાર્ટ-અપ કેન્દ્ર તરીકે સમાવેશ કરવામાં આવે છે.

રિપોર્ટ મુજબ ભારતનાં વિકસતાં અને સ્ટાર્ટ-અપનો પ્રાથમિક તબક્કામાંથી પસાર થતાં કેન્દ્રોમાં એજ્યુટેક, ફિનટેક, હેલ્થટેક અને રિટેલટેક જેવાં નવાં ક્રેન્ડોમાં જોવા મળે છે. દાયકા અગાઉ આ ક્રેન્ડોનું અસ્તિત્વ જ નહોતું. ભારતમાં મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને કારણે અમે ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં વધારો જોઈ રહ્યા હીએ, જે પ્રોત્સાહક છે.”

આ ઉપરાંત થિરુવનંતપુરમુ, કાનપુર, ચંદ્લિગઢ અને કોઈબતુરનો ઉલ્લેખ પ્રાથમિક તબક્કામાંથી પસાર થતાં સ્ટાર્ટ-અપ કેન્દ્રો તરીકે થયો છે, જ્યાં વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધી સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

અમદાવાદ-સ્થિત હિન્દીઆઈઆઈના દ્વારા ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર સેન્ટર ફીર એડવાન્સિંગ એન્ડ લોયિંગ એન્ટરપ્રાઇઝ (કેડલ)ના સીએઓ મધ્યક પટેલ કહું હતું કે, “છેલ્લાં થોડા વર્ષોમાં ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનો વિકાસ દેશના તમામ વિસ્તારોમાં થયો છે. આ બાબત ફેડ સ્ટાર્ટ-અપ્સની સંખ્યા, યુનિકોર્સની સંખ્યામાં વધારો તથા વિશિષ્ટ ડિજિટલ માળખા દ્વારા ભારત અને વિદેશમાં બજારના વિસ્તરણ સ્વરૂપે જોઈ શકાય છે. હકીકતમાં મોટા

ઈનોવેશન માટે અનુકૂળ માહોલ

- ઇન્ક્યુબેર્સની સહિય ભૂમિકા, સ્થાનિક સમૃદ્ધાચો અને શૈક્ષણિક સંસ્થાઓના સતત પ્રયાસોને પગલે ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમે દુનિયામાં ગીજું સ્થાન હાસલ કર્યું છે.
- ૨૦૧૪થી વર્ષ ૨૦૧૮ વચ્ચે નવ હજારથી વધુ સ્ટાર્ટ-અપ્સની સ્થાપના થઈ હતી
- નાસ્કોમ-ડિઝનોવના રિપોર્ટમાં અમદાવાદ ઉપરાંત જ્યાપુર, કોલકાતા અને કોચ્ચી વિકાસશીલ સ્ટાર્ટ-અપ કેન્દ્રોમાં આશરે ૧૫૦ સ્ટાર્ટ-અપ્સનાંથી આશરે ૪૩ ટકા ફેડ સ્ટાર્ટઅપ્સ અમદાવાદમાં છે. વિકસતાં કેન્દ્રોમાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં ૫૫ ટકાનો વધારો થયો છે, જ્યારે ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં ૧૨થી ૧૫ ટકાની વૃદ્ધિ થઈ છે.
- નાસ્કોમ ફાઉન્ડેશનના બોર્ડ મેબર તથા દેવ આઈટીના એમડી જેમિન શાહે કહું હતું કે, “રાજ્ય સરકારો પણ ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવા ફેડ પૂર્ણ પાડીને ટેકો આપી રહી છે. ઉદ્યોગ, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકો સાથે સ્થાનિક ઇકોસિસ્ટમનું નિર્માણ તથા નાસ્કોમ સેન્ટર ઓફ એક્સલન્સ - ઇન્ટરનેટ ઓફ ટિયર- આઈએટી દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે જોડાશી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધારે વેગ મળશે. નાસ્કોમ સીઓઈ-આઈએટી જેવી ઔદ્યોગિક સંસ્થાઓ આ શહેરોમાં ધીમી પણ મક્કમ ગતિએ કામગીરી વધારી રહી છે, જેને જંબંધિત રાજ્ય સરકારોનો સાથસહકાર મળી રહ્યો છે. પરિણામે સ્ટાર્ટ-અપ્સ, ઉદ્યોગસાહસો, સરકારી સંસ્થાઓ વચ્ચે જોડાણ થયું છે.”